

Date: 03/09/2022

To,
The Manager,
Listing Department,
National Stock Exchange of India Limited,
Exchange Plaza,
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai-400051

NSE Scrip Symbol: LGHL

Dear Sir/ Madam

# Subject: NEWSPAPER ADVERTISEMENT - NOTICE TO THE MEMBERS OF THE COMPANY REGARDING 13<sup>TH</sup> ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VC/OAVM

With reference to the above subject, please find enclosed herewith the copies of the public notice published in newspapers of Ahmedabad edition viz.

- (1) Page 7 Western Times (English) dated 03rd September 2022 and
- (2) Page 7 Western Times (regional language) 03rd September 2022

with respect to the 13th Annual General Meeting of the members of the company scheduled to be held on Friday, 30th September 2022 at 02:15 P.M. IST through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM).

You are requested to kindly take note of the same in your records.

Thanking You, Certified True Copy

FOP, LAXMI GOLDORNA HOUSE LIMITED

AHMEDABAD

Dhaval Parekh Company Secretar

Mem No: A50314

Encl: Copy of Newspaper Publication

Regd. Office:

Laxmi House, Opp Bandharano Khancho, M.G. Haveli Road, Manekchowk, Ahmedabad - 380001, Gujarat. 
© cs@laxmilifestyle.co.in | laxmigroup56@gmail.com | @ www.laxmilifestyle.co.in



પહોંચે,એક એક ઘર સુધી પહોંચે,

તેના માટે એક મહા અભિયાન

ચાલુ કરવાનું છે. જેણે અમે 'ગેરંટી

રજીસ્ટ્રેશન કેમ્પેન' તરીકે આગળ વધારવા ્જઈ રહ્યા છીએ.

આવતીકાલે ખૂબ જ શુભ દિવસ છે

આપણે ત્યાં પરંપરામાં મનાય છે

કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત

ગણપતિની પ્રાર્થનાથી થાય તો એ

કાર્ય સફળ થાય છે.પ્રેસ કોફરન્સ.માં આમ આદમી પાર્ટી

નાં વલસાડ જિલ્લા લોકસભા

પ્રમુખ રાજીવ પાંડે અને વલસાડ

જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈ

ઉપસ્થિત રહ્યાં હતાં.

(प्रतिनिधि)वापी, આમ આદમી પાર્ટીનું સંગઠન દ્વારા સોશિયલ મીડિયા કેમ્પેન હોય, આવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આમ આદમી પાર્ટી નો વિચાર એક એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. અને આ તમામ કાર્યક્રમના કારણે જનતાખેડૂતો હોય, મહિલાઓ હોય, તમામે લોકો અરવિંદ કેજરીવાલજી ઉપર ખૂબ ભરોસો કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે એક મોકો અરવિંદ કેજરીવાલ ને આપવામાં આવે. ગુજરાતના લોકો અરવિંદ કેંજરીવાલ ને એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલ એ પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને અમુક ગેરંટીઓ આપી છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરંટી શબ્દ વાપરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ એવા પહેલા નેતા છે જે કામ કરવાની ગેરંટી આપે છે અને એવું જાહેરમાં કહેવાની હિંમત રાખે છે કેં જો કામ પૂરું ન થાય તો બીજી વખત મત ના આપતા. અરવિંદ કેજરીવાલ એ પાછલા દિવસોમાં અલગ અલગ સેક્ટર પ્રમાણે ગેરંટીઓ આપેલી છે, જેમાં વીજળીને ગેરંટી છે, મહિલાઓની ગેરંટી છે, આદિવાસી સમાજની ગેરંટી છે, વેપારીઓની ગેરંટી છે, યુવાનો માટે રોજગારની ગેરંટી છે, શિક્ષા અને સ્વાસ્થની ગેરંટી છે, આ તમામ ગેરંટીઓ લોકોને આપી છે.

#### પશ્ચિમ રેલવે–અમદાવાદ

ગુજરાતના એક એક વ્યક્તિ સુધી

આ તમામ ગેરંટીઓ

બે લેન રોડ ઓવર બ્રિજનું બાંધકામ મારતના રાષ્ટ્રપતિ માટે અને વતી **ડેપ્યુ. ચીફ એન્જીનીયર (બાંધકામ) III,** પશ્ચિમ રેલવે, અમદાવાદ દ્વારા નીચે જણાવેલ કાર્ય માટે ઈ-ટેન્ડર આમંત્રિત કરે છે. **ઈ-ટેન્ડર** નોટીસ નં. ડેપ્યુ.સીઈ(સી)ાા/એડીઆઈ/ એમએસએચ-પીએનયુ/પીએસએસએ/01 (1) **કામનું નામ તેના સ્થળ સહિતઃ** રેલવે કિ.મી. 0/0 ર્ય 37/200 (SH72) વચ્ચે Ch. 16/700 ર્થ 17/300 વચ્ચે પાલનપર-ગાંધીધામ રેલવે લાઈન પ લેવલ ક્રોસિંગ નં. 62-SPL ને બદલે બે લેન રોડ ઓવર બ્રિજનું બાંધકામ. **(2) કામની અંદાજિત કિંમત**ા ₹ 3,51,67,374.00 (3) જમા કરવાની અર્નેસ્ટમની ડિપોઝીટઃ ₹ 3,25,900.00 (4) પૂર્ણ **કરવાનો સમયગાળોઃ** 18 (અઢાર) મહિના **(5) પ્રી**-**બીડ કોન્ફરન્સઃ** 05-09-2022 ના 12:00 કલાકે (6) બીડ દસ્તાવેજ માટે રિક્વેસ્ટની છેલ્લી તારીખઃ તા.30-09-2022 ના 11:00 કલાકે. **(7) નિયત તારીખઃ** તા.30-09-2022 ના 11:00 કલાકે. **(8)** કલમ નં. 2. 11. 2 માં સૂચિબદ્ધ તમામ દસ્તાવેજોની **પ્રત્યક્ષ રજૂઆત :** તા.05-10-2022 ના 15:00 કલાક સુધી. **(9) ટેકનિકલ બીડ્સ ખુલવાની તારીખ** તા.05-10-2022 ના 15:30 કલાકે. (10)

## अभने साग्रङ हरोः f facebook.com/WesternRly

**ટેન્ડરીંગ સિસ્ટમ**ઃ બે પેકેટ સિસ્ટમ. (10) **વેબસાઈ** 

વિગત, નોટીસ બોર્ડનું સરનામું જ્યાં ટેન્ડરની સંપૂર્ણ

**વિગત જોઈ શકાશે અને ઓફીસનું સરનામું:** ડેપ્યુ. ચી: મેન્જીનીયર, (બાંધકામ) III, પશ્ચિમ રેલવે, બીજો માળ

નિર્માણ ભવન, ડીઆરએમ ઓફિસ પાસે, અસારવા

નમદાવાદ. **વેબસાઈટઃ <u>www.ireps.gov.in</u>** 

#### પશ્ચિમ રેલવે – ભાવનગર ડિવિઝન બોગી ફ્રેમ અને તેના ભાગોની સફાઈ અને પેઈન્ટીંગ

નારતના રાષ્ટ્રપતિ માટે અને વતી ડેપ્યુટી ચીફ મિકેનીક**્** ભાવનગર પરા દ્વારા નીચે આપેલ વિગતો મજબ ઈ–ટેન્ડ આવકારે છે. **ઈ-ટેન્ડર નોટીસ નં. બીવીપીડબલ્યુ**-2022-23-Bshot-06 (1) ક્રામનું નામઃ શોટ/ગ્રી મ્લાસ્ટીંગ દ્વારા બોગી ક્રેમ અને તેના ભાગોની સકાઈ અ સાફ કરેલી બોગી ફ્રેમ અને તેના ભાગો પર પેઈન્ટીંગ. (2) કામની અંદાજિત કિંમતઃ ₹ 99,77,458.84/- (3) જમા કરાવવાની બીડ સિક્યરીટી ડિપોઝીટ ₹ 1,99,600/- (4) બીડ જમા કરાવવાની અને બીડ **ખુલવાની તારીખઃ** તા.19-09-2022 ના 15:00 કલાક સધી જમા કરાવી શકાશે અને તા.19-09-2022 ના  $15\overset{\circ}{.}30$  કલાક પછી ખોલાશે. (5) **વેબસાઈટ વિગત અને ઓફીસનું સરનામું:** સીડબલ્યુએમ-બીવીપી ઓફીસ

ાબસાઈટઃ www.ireps.gov.in અમને લાઇક કરોઃ 🚹 facebook.com/WesternRlv

કેરેજ રિપેર વર્કશોપ ભાવનગર પરા-364003

### રોબર્ટ રિસોર્સિસ લિમિટેડ

૨જી. ઓફિસ : ત્રીજો માળ, પ્લોટ નં.૧૦૬૭, બિંદુ નિવાસની સામે, કાળીયાબીડ રોડ, ભાવનગર-364001, ગુજરાત, સંપર્કે નં. +91-6358905872 ઇમેઇલ : robertresourceslimited@gmail.com વેબસાઇટ : www.robertresources.com CIN: - L99999GJ1982PLC096012

#### ૪૦મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ

આથી સભ્યો ને જણાવવામાં આવે છે કે કંપની ના સભ્યો ની ૪૦ મી વાર્ષિક સામાન્ય સભા(એ.જી.એમ) ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ શુક્રવાર ના રોજ સાંજે પ.૦૦ વાગ્યે કેપની ની રર્જસ્ટાર ઓફિસે એ.જી.એમ નોટિસ માં નિર્ધારિત વ્યવસાય નો વ્યવहાર કરવા માટે યોજાશે.

સંબધિત પરિપત્રોના પાલન કરતાં એ.જી.એમ ની નોટિસ અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના વાર્ષિક અદેવાલની ઇલેક્ટ્રોનિક નકલો જેમના ઇ-મેઇલ સરનામાં કંપની / ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ (ેઓ) સાથે નોંધાચેલા છે તે તમામ શેરધારકોને મોકલવામાં આવશે. ડિમટીરિયલાઇઝડ મોડમાં શેર ધરાવનારા શેર हોલ્ડરો અને જેમના ઇમેઇલ સરનામાં રજસ્ટર નથી તેમને तेम्ना डिपोळीटरी पार्टिसिपन्ट (ओ) मारङ्ते तेमना ध-मेधल सरनामां અને મોબાઇલ નંબર તેમની સંબંધિત કિપોઝિટરી સાથે નોંધાવવા વિનંતી કરવામાં આવે છે. ફિજીકલ મોડમાં શેર ધરાવતા શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના શેર ડીમેટ મોડમાં તબદીલ કરાવી લે અને તેમના ઇમેઇલ સરનામાં અને મોબાઇલ નંબર કંપની ના ઈમેલ આઇડી robertresourceslimited@gmail.com અને તેના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ એટલે કે સ્કાચલાઇન ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ના ઈ મેલ આઇડી info@skylinerta.com પર અપડેટ કરાવી લે. ૪૦મી એજીએમ ની નોટિસ અને વાર્ષિકઅદેવાલનાણાકીય વર્ષ ૨૦૨૧-રરના કંપનીની વેબસાઇટ www.robertresources.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.msei.in અને www.cse-india.com પર પણ ઉપલબ્ધ કરાશે.

એ.જી.એમ નોટિસ માં દર્શાવ્યા મુજબ ના ઠરાવો પર કંપની એ રિમોટ ઈ વોર્ટિંગ ની સગવડ આપી છે એ મારફતે ઇલેક્ટ્રોનિક્સ પધ્ધતિ થી વોટ આપી શકશે. મતદાન કરવાની રીત ડિમટીરિયલાઈઝડ મોડ, ફિઝિકલ મોડમાં શેર ધરાવનારા શેરધારકો અને શેરધારકો કે જેમણે તેમના ઇમેઇલ સરનામાં રજીસ્ટર કર્યા નથી તે શેરધારકોને નોટિસ સાથે મોકલવામાં આવશે.

જે સભ્યોએ તેમનું ઇમેઇલ સરનામું નોંધાવ્યું નથી તેમને નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવે છે.કંપની૪૦મી એજીએમની નોટિસઅને વાર્ષિક અહેવાલવર્ષ ૨૦૨૧-૨૨ ની સૂચના ફક્ત તે શેરધારકોને જ મોકલશે જેમના ઇ-મેઇલ આઈડી કંપની / ડિપોંઝિટરી પાર્ટિસિપન્ટ સાથે નોંધાચેલા છે.

સ્થળ : ભાવનગર. તારીખ : ૨ સપ્ટેમ્બર, ૨૦૨૨

અમી કોઠારી કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફિસર

રોબર્ટ રિસોર્સિસ લિમિટેક વતી,

# ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો માટે સર્ટિફિકેટ કેમ્પ ચોજાચો



(પ્રતિનિધિ)બાચડ, અરવલ્લી જિલ્લાના ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો માટે સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ માં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહૃાા હતા.અને સર્ટિફિકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ કેમ્પ માં ઓર્થો સર્જન,આંખના સર્જન, માનસિક ક્ષતિ માટે ના ડોકટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને દિવ્યાંગ ભાઈ બહેનો ની તપાસ કરી હતી.આ કેમ્પ માં દિવ્યાંગ ભાઈ બહેનો એ ક્ષતિના યુ.ડી.આઈ.ડી સર્ટિ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા સર્ટિ ના રજિંસ્ટ્રેશન બાદ આ આવ્યા બાદ દિવ્યાંગ ભાઈ બહેનો ના નિવાસસ્થાન સુધી પહોચાડવા માટે અરવલ્લી ફિજીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ,બુટાલ ના વિનોદચંદ્ર પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું

આ કેમ્પ નું આયોજન જિલ્લા સમાજ સુરક્ષા ની કચેરી,સિવિલ હોસ્પિટલ હિંમતનગર અને અરવલ્લી ફિજીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ,બુટાલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં તજજ્ઞ ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં ૨૦૦ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સાથે કાર્યક્રમ માં અલ્પઆહાર નું આયોજન સર્ટિસમાજ સુરક્ષા કચેરી માં કરવામાં આવ્યું હતું.

#### VINYOFLEX LIMITED

Regd. Off: 307, Silver Chamber, Tagore Road, Rajkot - 360 002. CIN: L25200GJ1993PLC019830 Ph.: 0281-2468345, 2468776 Fax: 0281-2468839 Web site: www.vinyoflex.com · E mail: info@vinyoflex.com

#### NOTICE OF 29<sup>™</sup> ANNUAL GENERAL MEETING, **EVOTING INFORMATION, BOOK CLOSURE AND RECORD DATE**

1. Notice is hereby given that the 29th Annual General Meeting of Members of VINYOFLEX LIMITED will be held at registered office situated at 307, Silver Chambers, Tagore Road, Rajkot on Thursday 29th September, 2022 at 11.00 A. M. to transact the Ordinary Businesses, As set out in the Notice dated 01st September 2022 in compliance with the applicable provisions of the Companies Act, 2013 and rules farmed there under and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Notice of AGM, Annual Report and Attendance Slip has been sent in Electronic Mode to all Members in the Permitted Mode. The above documents are also available on the Company's Website www.vinyoflex.com.

#### 2. Dispatch of Annual Report through E-mail Only:

Members may note that the Annual Report of the Company for the Financial Year 2021-22 along with Notice convening the AGM has been sent only through email to all those Members whose email addresses were registered with the Company/RTA or with their respective Depository Participant(s) (DP)

as on the date 30-08-2022, in accordance with the MCA Circulars and Circular

No. SEBI/HO/CFD/CMD1/CINP/2020/79 dated May 12, 2020, January 15, 2021 and May 13, 2022 issued by SEBI. Further. Members holding shares in physical form and who have not yet registered/updated their email address are requested to update their Mail Id by submitting forms given at the website of the Company **www.vinyoflex.com** 

#### 3. Remote E voting Information:

In compliance with provisions of section 108 of the Companies Act, 2013 read with rules made there under as amended from time to time and Regulation44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Company is pleased to provide members facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means through e-Voting Services provided by National Securities Depository Limited (NSDL). All members are informed that

- 1) The businesses as stated in the Notice of 29th AGM will be transacted through voting by electronic means; 2) The e-voting period commences as on Saturday, 24th September 2022 (9 a.m.) and ends on Wednesday,
- 28th September 2022 (5 p.m.). 3) The cut-off date for determining the eligibility to cast vote by electronic means is September 22, 2022.

4) A person who is not a Member as of the Cut-off date should treat this notice for Information purpose only. The persons who acquire shares and become members of the Company after dispatch of the Notice of AGM through Email and holding shares as on the cut-off date i.e. September 22, 2022 may obtain Login Id and Password by sending a request on or before September 22, 2022 at evoting@nsdl.co.in or info@vinyoflex.com and may cast their votes by following the instructions and process of e-voting as provided in the Notice of AGM.

5) In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section o www.evoting.nsdl.com or call on toll free no.: 1800  $1020\,990\,$  and  $\,1800\,22\,44\,30\,$  or send a request to at evoting@nsdl.co.in.

6) The members may note that: (a) once the e-vote on resolution is cast by members, they shall not be allowed to change it subsequently, (b) The members who have cast their vote by remote e-voting may also attend physical AGM but shall not be entitled to cast their vote again.

#### 1. Book Closure and Record Date:

Pursuant to Regulation 42 and 60 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 91 of the Companies Act, 2013 and the applicable Rules there under the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Tuesday 20th September, 2022 To Thursday, 29th September, 2022 (Both Days Inclusive) for the purpose of AGM and cut-off date (record date) is 22rd September

The said notice is also available on website of stock exchanges www.bseindia.com and on company's website

Date:03-09-2022 Place: Rajkot

લેસ્ટર્ન ટાઇસ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

જાહેરાતો અંગે વાંચકોએ

પોતાની રીતે ચકાસણી કરી

-જાહેરખબર મેનેજર

નિર્ણય લેવો.

by Order & behalf of the Board of Directors for Vinyoflex Ltd.

> CS. RAHUL KHOKHAR **COMPANY SECRETARY** M.NO. A62029

## 🗱 SONA HI SONA

#### સોના હી સોના જ્વેલર્સ (ગુજરાત)લિમિટેડ

CIN: L36910GJ2010PLC059513 ૨જી.ઓફીસ : ૭, મિલેનિયમ પ્લાઝા, સ્વામિનારાયણ મંદિર સામે, માનસી ક્રોસ રોડ, વસ્ત્રાપુર, ત્રમદાવાદ. ગુજરાત-૩૮૦૦૧૫. • Email: cs@sonahisona.com, Website: www.sonahisona.com

વીસી/ઓએવીએમના માધ્યમથી ચોજાનારી 13મી વાર્ષિક સામાન્ય સભા માટે કંપનીના સભ્યોને નોટિસ

આથી નોટિસ જારી કરવામાં આવે છે કે કંપની એકટ, 2013 (કાયદો) અને તે અંતર્ગત ઘડાયેલા અને સાથે વંચાણે લેવાનારા સંબંધિત નિયમો તથા સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિકવાયરેમેન્ટ્સ) નિયમો, 2015 અને કંપની બાબતોના મંત્રાલય દ્વારા તારીખ 8 એપ્રિલ, 2020, 13 એપ્રિલ, 2020 તથા 05 મે, 2020ના રોજ અનુક્રમે જારી કરાયેલા સામાન્ય પરિપત્રો નં. 14/2020, 17/2020, અને 20/2020, તથા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા તારીખ 12 મે, 2020ના રોજ જારી કરાયેલા પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 અને 13 જાન્યુઆરી, 2021 અને 14 ડીસેમ્બર, 2021ના પરિપત્ર નંબર 02/2021 તેમજ સેબી તથા કંપની બાબતોના મંત્રાલય દ્વારા સમયાંતરે જારી કરાયેલા અન્ય સંલગ્ન પરિપત્રોમાં દર્શાવાયેલ પ્રક્રિયાના અનુસણ અંતર્ગત એજીએમ (એજીએમ નોટિસ)ની નોટિસમાં દર્શાવેલ કામગીરી સંદર્ભે સોના હી સોના જ્વેલર્સ (ગુજરાત) લિમિટેડ (કંપની)ની 13મી વાર્ષિક સામાન્ય સભા ગુરૂવાર, 29 સપ્ટેમ્બર, 2022ના રોજ બપોરે 3.00 કલાકે વિડીયો કોન્ફરન્સિંગ (વીસી) અથવા અધર ઓડીયો વિઝ્યુઅલ મીન્સ (ઓએવીએમ)ના માધ્યમથી સભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વગર યોજાશે.વધમાં. સેબીએ ૧૩ મે. ૨૦૨૨ ના તેના પરિપત્ર દ્વારા સૂચિબદ્ધ સંસ્થાઓને તેમનો વાર્ષિક અહેવાલ ઈલેકટ્રોનિક મોડ (સેબી)માં મોકલવાની મંજૂરી આપી છે.

એમસીએ પરિપત્રો/અને સેબીના પરિપત્રોને અનુરૂપ જે સભ્યોના ઈ-મેઈલ એડ્રેસ કંપની/ડિપોઝિટરીઝ પાસે નોંધાયેલા હશે તેમને 13મી એજીએમની નોટિસ તથા નાણાંકીય વર્ષ 2021-2022નો વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મોકલી અપાશે.

- સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સના માધ્યમથી ડિપોઝિટરીમાં ઈલેક્ટ્રોનિક/ડિમેટ હોલ્ડિંગ્સના સંદર્ભમાં. જો કે સભ્યો કંપનીને cs@sonahisona.com પર ઈમેલ દ્વારા પોતાનું નામ, ડીપી, ઈડી, ક્લાયન્ટ આઈડી, પાન, મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ જેવી વિગતો ઉપલબ્ધ બનાવીને કામચલાઉ નોંધણી કરાવી શકે છે.
- સભ્યો દ્વારા કંપનીના તમામ ઈક્વિટી શેર્સ ડિમટિરયલાઇઝ્ડ સ્વરૂપે છે.

સભ્યો 13મી એજીએમમાં માત્ર VC/OAVM સુવિધાના માધ્યમથી જ ભાગ લઈ શકશે. ઈ-વોટિંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે કંપની દ્વારા નેશનલ સિક્યોરિટીઝ હેપોઝિટરીઝ લિમિટેડ (એનએસડીએલ)ના માધ્યમથી જરૂરી તમામ વ્યવસ્થા કરેલી છે. 13મી એજીએમમાં ભાગ લેવાની માહિતી તથા રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ અથવા ઈ-વોટિંગ પદ્ધતિથી મતદાન કરવા માટેની તમામ વિગતો 13મી એજીએમની નોટિસમાં જણાવાઈ છે. કંપની એક્ટ, 2013ની કલમ 103 અન્વયે કોરમની ગણતરીના હેતુથી વીસી/ઓવીએમના માધ્યમથી ભાગ લેનારા સભ્યોની સંખ્યાની ગણના કરાશે. 13મી એજીએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.sonahisona.com પર તથા એનએસઈ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ www.nseindia.com પર પણ ઉપલબ્ધ બનશે.

એજીએમમાં મતદાનના અધિકાર માટે તથા 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષ માટે યોગ્યતા ધરાવતા સભ્યો નિર્ધારિત કરવા માટેની રેકોર્ડ તારીખ ગુરૂવાર, 22 સપ્ટેમ્બર, 2022 નિર્ધારિત કરાઈ છે.

ઉપરોક્ત માહિતી કંપનીના સભ્યોની જાણકારી તથા લાભ માટે પ્રકાશિત કરાઈ છે અને તે એમસીએ/સેબીના પરિપત્રોને અનુરૂપ છે.

સોના હી સોના જ્વેલર્સ (ગુજરાત) લિમિટેડ, વતી સહી/- **વિજય સી. શાહ** તારીખ : 02/09/2022 (મેનેજિંગ ડિરેકટર) સ્થળ : અમદાવાદ.

## દેગાવાડા ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના ७૩ માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

દેવગઢબારીયા તાલુકા કક્ષાના ૭૩ માં વન મહોત્સવની ઉજવણી દેગાવાડા પ્રાથમિક શાળાના પટ્ટાગણમાં ધારાસભ્ય બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ વન મહોત્સવની ઉજવણીમાં શાળાની વિધાર્થિનીઓએ મહાનુભાવોને કુમ કુમ તિલક કરી પુષ્પગુચ્છ થી રવાગત કરવામાં આવ્યું હતું. જે પછી સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો માટે સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

(પ્રતિનિધિ) દે.બારીયા,

વેસ્ટર્ન ટાઇસ્સ

તાલુકા કક્ષાની આ ખાસ ઉજવણીંમાં વનવિભાગ દેવગઢબારીયાના વન સંરક્ષકશ્રી આર.એમ પરમાર તથા સામાજિક વનિકરણ વિભાગ દાહોદ જિલ્લાના અધિકારીશ્રી અમિત કુમાર નાયકની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આમંત્રિત મહાનુભાવોના સ્વાગત પછી તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગામડાની વન મંડળીઓને મળવા પાત્ર લાભોના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.

#### **TIRUPATI SARJAN LIMITED**

CIN: L45100GJ1995PLC024091

Registered Office: 11,12,13Satyamev Complex, Opp.Gujarat High Court, S.G.Road, Ahmedabad-380060 Website: www.tirupatisarjan.com Email Id: info@tirupatisarjan.com Contact: +91-79-2766 2013.

27th ANNUAL GENERAL MEETING OF TIRUPATI SARJAN LIMITED Members are requested to note that the 27th Annual General Meeting ("27th AGM" or "Meeting") of TirupatiSarjan Limited ("the Company") will be held on Wednesday, September 28, 2022 at 4:00 P.M. IST at A-11,12,13, Satyamev Complex, Opp. Gujarat High Court, S.G. Highway, Ahmedabad - 380060 to transact the businesses to be set out in the notice of the Meeting ("AGM Notice"), in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder, read with general circular no. 20/2020 dated May 5, 2020, general circular no. 2/2022 dated May 5, 2022 and other related circulars issued by the Ministry of Corporate affairs, SEBI circular no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 and applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. In compliance with the above circulars, electronic copies of the AGM Notice including the procedure and instructions for remote e-voting or voting at the Meetingand the Annual Report 2021-22 will be sent to all thoseMembers whose email addresses are registered with the

The AGM Notice and the Annual Report 2021-22 willbe made available on the Company's website at https://www.tirupatisarjan.com/, on the website of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and on the website of of National Securities Depository Limited athttps://www.evoting.nsdl.com/. The Company will provide the facility to its Members to exercise their right to vote by electronic means through remote e-voting at the 27th AGM. The instructions on the process of remote e-voting, including the manner in which Members holding shares in physical form or who have not registered their

email address can cast their vote through remote e-voting or physical voting at

the Meeting, will be provided as part of the AGM Notice

Members who have not registered their email address are requested to register the same in respect of shares held in demat mode with the concerned Depository Participant and in respect of shares held in physical mode by writing to Bigshare Services Pvt Ltd, the Registrar and Transfer Agent of the Company, at their address A-802, Samudra Complex, Near Klassic Gold Hotel, Off C.G Road, Navrangpura, Ahmedabad 380009 or at bssahd

Place: Ahmedabad Date: September 02, 2022

Company/Depositories.

For Tirupati Sarjan Limited Sd/- Yash Nayak Company Secretary & Compliance Officer

#### પશ્ચિમ રેલવે – રાજકોટ ડિવિઝન

પાર્કિંગ અને શૌચાલયનું સંચાલન અને જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ ટેન્ડર નોટીસ નં. RJTPARK5 & RJTPAYUSE4 ાજકોટ ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ સ્ટેન્ડ અને પે એન્ડ યુઝ શૌચાલયનું સંચાલન અને જાળવણીન ોન્ટ્રાક્ટ માટે આઈઆરઈપીએસ પર ઈ-ઓક્શન માટેટેન્ડર નોટીસ.

| અનું.<br>નં. | લોટ નં./કેટેગરી                                       | વિગત   | ઓક્શન<br>તારીખ અને સમય    | કોન્ટ્રાક્ટ<br>સમયગાળો |
|--------------|---|--|---------------------------|------------------------|
| AA/1         | PARKING-RJT-<br>RJT-FW-5-22-2<br>(પાર્કિંગ-FW)        | રાજકોટના સર્કયુલેટીંગ વિસ્તાર સ્થળ ખાતે ફોર<br>ચ્હિલર્સ (કાર/બસ/મિની બસ) માટે પાર્કિંગ<br>લોટ.                                     | 12-09-2022<br>11:00-11:30 | 1096<br>દિવસ           |
| AB/1         | PARKING-RJT-<br>OKHA-MX-12-22-1<br>(પાર્કિંગ-મિક્સડ)  | ઓખાના સર્કયુલેટીંગ વિસ્તાર સ્થળ ખાતે ટુ /<br>થ્રી / ફોર વ્હિલર્સ માટે પાર્કિંગ લોટ.  | 12-09-2022<br>11:00-11:40 | 1096<br>દિવસ           |
| AB/2         | PARKING-RJT-<br>DWK-MX-13-22-1<br>(પાર્કિંગ-મિક્સડ)   | દ્વારકાના સર્કયુલેટીંગ વિસ્તાર સ્થળ ખાતે ટુ / થ્રી<br>/ ફોર વ્હિલર્સ માટે પાર્કિંગ લોટ.  | 12-09-2022<br>11:00-11:50 | 1096<br>દિવસ           |
| AB/3         | PARKING-RJT-<br>RJT-MX-14-22-1<br>(પાર્કિંગ-મિક્સડ)   | રાજકોટ ગુડ્ઝ શેડ ઓફિસ (આઈઓસી ડેપો<br>સામે) જામનગર રોડ પાસે ખાતે ટુ/થ્રી/ફોર<br>વ્હિલર્સમાટે પાર્કિંગલોટ.                           | 12-09-2022<br>11:00-12:00 | 365<br>દિવસ            |
| AB/4         | PARKING-RJT-<br>Hapa-MX-6-22-2<br>(પાર્કિંગ-મિક્સડ)   | હાપાના સર્કયુલેટીંગ વિસ્તાર સ્થળ ખાતે ટુ / થ્રી<br>/ ફોર વ્હિલર્સ માટે પાર્કિંગ લોટ.   | 12-09-2022<br>11:00-12:10 | 1096<br>દિવસ           |
| AB/5         | PARKING-RJT-<br>MVI-MX-8-22-2<br>(પાર્કિંગ-મિક્સડ)    | મોરબીના સર્કયુલેટીંગ વિસ્તાર સ્થળ ખાતે ટુ /<br>થ્રી / ફોર વ્હિલર્સ માટે પાર્કિંગ લોટ.  | 12-09-2022<br>11:00-12:20 | 1096<br>દિવસ           |
| AB/6         | PARKING-RJT-<br>WKR-MX-7-22-2<br>(પાર્કિંગ-મિક્સડ)    | વાંકાનેરના સર્કયુલેટીંગ વિસ્તાર સ્થળ ખાતે ટુ /<br>થ્રી / ફ્રોર વ્હિલર્સ માટે પાર્કિંગ લોટ.   | 12-09-2022<br>11:00-12:30 | 1096<br>દિવસ           |
| AB/7         | PARKING-RJT-<br>SUNR-MX-9-22-2<br>(પાર્કિંગ-મિક્સડ)   | સુરેન્દ્રનગરના સર્કયુલેટીંગ વિસ્તાર સ્થળ ખાતે ટુ<br>/ થ્રી / ફોર વ્હિલર્સ માટે પાર્કિંગ લોટ.                                       | 12-09-2022<br>11:00-12:40 | 1096<br>દિવસ           |
| AA/1         | PnU-RJT-OKHA-<br>Toi-3-22-2 (પે એન્ડ<br>યુઝ-ટોયલેટ્સ) | ઓખાના સર્ક્યુલેટીંગ વિસ્તારમાં પ્રિફેબ્રીકેટેડ<br>શૌચાલયો / યૂરિનલ્સ માટે સંચાલન અને<br>જાળવણી.                                    | 12-09-2022<br>11:00-11:30 | 1096<br>દિવસ           |
| AA/2         | PnU-RJT-DWK-<br>Toi-4-22-1 (પે એન્ડ<br>યુઝ-ટોયલેટ્સ)  | દ્વારકા ખાતે પ્લેટફોર્મ નં. 1 પર સ્લિપર ક્લાસ<br>વેઈટીંગ રૂમ ખાતે સામાન્ય શૌચાયલો/<br>યૂરિનલ્સ/બાથરૂમોમાટે સંચાલન અને જાળવણી       | 12-09-2022<br>11:00-11:40 | 1096<br>દિવસ           |
| AA/3         | PnU-RJT-JAM-<br>Toi-5-22-2 (પે એન્ડ<br>યુઝ-ટોયલેટ્સ)  | જામનગરના સર્ક્યુલેટીંગ વિસ્તારમાં પ્રિફેબ્રીકેટેડ<br>શૌચાલયો / યૂરિનલ્સ માટે સંચાલન અને<br>જાળવણી.                                 | 12-09-2022<br>11:00-11:50 | 1096<br>દિવસ           |
| AA/4         | PnU-RJT-BKNG-<br>Toi-6-22-1 (પે એન્ડ<br>યુઝ-ટોયલેટ્સ) | ભક્તિનગરના સર્કયુલેટીંગ વિસ્તારમાં<br>પ્રિફેબ્રીકેટેડ શૌચાલયો / યૂરિનલ્સ માટે સંચાલન<br>અને જાળવણી.                                | 12-09-2022<br>11:00-12:00 | 1096<br>દિવસ           |
| AA/5         | PnU-RJT-JAM-<br>Toi-8-22-1 (પે એન્ડ<br>યુઝ-ટોયલેટ્સ)  | જામનગર ખાતે પ્લેટફોર્મ નં. 1 પર સ્લિપર ક્લાસ<br>વેઈટીંગ રૂમ ખાતે સામાન્ય શૌચાયલો/યૂરિનલ્સ/<br>બાથરૂમો માટે સંચાલન અને જાળવણી       | 12-09-2022<br>11:00-12:10 | 1096<br>દિવસ           |
| AA/6         | PnU-RJT-DWK-<br>Toi-4-22-1 (પે એન્ડ<br>યુઝ-ટોયલેટ્સ)  | ઓખાના સર્ક્યુલેટીંગ વિસ્તારમાં પ્રિફેબ્રીકેટેડ<br>શૌચાલયો / યૂરિનલ્સ માટે સંચાલન અને<br>જાળવણી.                                    | 12-09-2022<br>11:00-12:20 | 1096<br>દિવસ           |
| AA/7         | PnU-RJT-SUNR-<br>Toi-7-22-1 (પે એન્ડ<br>યઝ-ટોયલેટસ)   | સુરેન્દ્રનગર ખાતે પ્લેટફોર્મ નં. 1 પર સ્લિપર ક્લાસ<br>વેઈટીંગ રૂમ ખાતે સામાન્ય શૌયાયલો/યૂરિનલ્સ/<br>બાળસ્મો માટે સંગાલન અને જળવાગી | 12-09-2022<br>11:00-12:30 | 1096<br>દિવસ           |

અમને લાઇક કરોઃ 📑 facebook.com/WesternRly • અમને ફોલો કરોઃ 🛂 twitter.com/WesternRly

#### ≚ caxmાલક્ષ્મી ગોલ્ડઓર્ના હાઉસ લિ<mark>મિટેડ</mark> CIN: L36911GJ2010PLC059127

**૨જી.ઓફીસ**ઃ લક્ષ્મી હાઉસ, બંધારાનો ખાંચો, એમ.જી. હવેલી રોડ, માણેકચોક, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત, ઈન્ડિયા.

બાથરૂમો માટે સંચાલન અને જાળવણી

Email: cs@laxmilifestyle.co.in • Website: www.laxmilifestyle.co.in <u>વીસી/ઓએવીએમના માધ્યમથી ચોજાનારી 13મી વાર્ષિક</u> સામાન્ય સભા માટે કંપનીના સભ્યોને નોટિસ

આથી નોટિસ જારી કરવામાં આવે છે કે કંપની એકટ, 2013 (કાયદો) અને તે અંતર્ગત ઘડાયેલા અને સાથે વંચાણે લેવાનારા સંબંધિત નિયમો તથા સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિકવાયરેમેન્ટ્સ) નિયમો, 2015 અને કંપની બાબતોના મંત્રાલય દ્વારા તારીખ 8 એપ્રિલ, 2020, 13 એપ્રિલ, 2020 તથા 05 મે, 2020ના રોજ અનુક્રમે જારી કરાયેલા સામાન્ય પરિપત્રો નં. 14/2020, 17/2020, અને 20/2020, તથા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા તારીખ 12 મે. 2020ના રોજ જારી કરાયેલા પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 અને 13 જાન્યુઆરી, 2021 અને 14 ડીસેમ્બર, 2021ના પરિપત્ર નંબર 02/2021 તેમજ સેબી તથા કંપની બાબતોના મંત્રાલય દ્વારા સમયાંતરે જારી કરાયેલા અન્ય સંલગ્ન પરિપત્રોમાં દર્શાવાયેલ પ્રક્રિયાના અનુસરણ અંતર્ગત એજીએમ (એજીએમ નોટિસ)ની નોટિસમાં દર્શાવેલ કામગીરી સંદર્ભે લક્ષ્મી ગોલ્ડઓર્ના હાઉસ લિમિટેડ (કંપની)ની 13મી વાર્ષિક સામાન્ય સભા શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2022ના રોજ બપોરે 2.15 કલાકે વિડીયો કોન્ફરન્સિંગ (વીસી) અથવા અધર ઓડિયો વિઝ્યુઅલ મીન્સ (ઓએવીએમ)ના માધ્યમથી સભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વગર યોજાશે. વધુમાં, સેબીએ ૧૩ મે, ૨૦૨૨ ના તેના પરિપત્ર દ્વારા સૂચિબદ્ધ સંસ્થાઓને તેમનો વાર્ષિક અહેવાલ ઈલેકટ્રોનિક મોડ (સેબી)માં મોકલવાની મંજૂરી આપી છે.

એમસીએ પરિપત્રો/અને સેબીના પરિપત્રોને અનુરૂપ જે સભ્યોના ઈ-મેઈલ એડ્રેસ કંપની/ડિપોઝિટરીઝ પાસે નોંધાયેલા હશે તેમને 13મી એજીએમની નોટિસ તથા નાણાંકીય વર્ષ 2021-2022નો વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મોકલી અપાશે. (1) સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સના માધ્યમથી ડિપોઝિટરીમાં ઈલેક્ટ્રોનિક/ડિમેટ

- હોલ્ડિંગ્સના સંદર્ભમાં. જો કે સભ્યો કંપનીને cs@laxmilifestyle.co.in પર ઈમેલ દ્વારા પોતાનું નામ, ડીપી, ઈડી, ક્લાયન્ટ આઈડી, પાન, મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ જેવી વિગતો ઉપલબ્ધ બનાવીને કામચલાઉ નોંધણી કરાવી શકે છે.
- સભ્યો દ્વારા કંપનીના તમામ ઈક્વિટી શેર્સ ડિમટિરયલાઇઝ્ડ સ્વરૂપે છે.

સભ્યો 13મી એજીએમમાં માત્ર VC/OAVM સુવિધાના માધ્યમથી જ ભાગ લઈ શકશે. ઈ-વોટિંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે કંપની દ્વારા નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (એનએસડીએલ)ના માધ્યમથી જરૂરી તમામ વ્યવસ્થા કરેલી છે. 13મી એજીએમમાં ભાગ લેવાની માહિતી તથા રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ અથવા ઈ-વોટિંગ પદ્ધતિથી મતદાન કરવા માટેની તમામ વિગતો 13મી એજીએમની નોટિસમાં જણાવાઈ છે. કંપની એક્ટ, 2013ની કલમ 103 અન્વયે કોરમની ગણતરીના હેતુથી વીસી/ઓવીએમના માધ્યમથી ભાગ લેનારા સભ્યોની સંખ્યાની ગણના કરાશે. 13મી એજીએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.laxmilifestyle.co.in પર તથા એનએસઈ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ www.nseindia.com પર પણ ઉપલબ્ધ બનશે.

એજીએમમાં મતદાનના અધિકાર માટે તથા 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષ માટે યોગ્યતા ધરાવતા સભ્યો નિર્ધારિત કરવા માટેની રેકોર્ડ તારીખ શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2022 નિર્ધારિત કરાઈ છે.

ઉપરોક્ત માહિતી કંપનીના સભ્યોની જાણકારી તથા લાભ માટે પ્રકાશિત કરાઈ છે અને તે એમસીએ/સેબીના પરિપત્રોને અનુરૂપ છે. લક્ષ્મી ગોલ્ડઓર્ના હાઉસ લિમિટેડ વતી,

જચેશ ચીનુભાઈ <mark>શાહ</mark>

#### પશ્ચિમ રેલવે – અમદાવાદ કિવિઝન

<u>વોટર વેન્ડિંગ મશીનનું ઈન્સ્ટોલેશન અને ઓપરેશન</u> નં. WR-ADI0COMM(7WVM)/1/2020/O/o SR DCM/ADI/WR તા. 29.08.2022

રતના રાષ્ટ્રપતિ માટે અને વતી ડિવિઝનલ રેલવે મેનેજર (કોમર્શિયલ), અમદાવાદ ડિવિઝન, પશ્ચિમ રેલવે દ્વારા કંપની: ાક્ટ,  $20\hat{13}$ / પાર્ટનરશીપ એક્ટ, 1932 હેઠળ પાર્ટનરેશીપ ફર્મ રર્જીસ્ટર્ડ થયેલ વ્યક્તિઓ / સોલ પ્રોપ્રાઈટર ફર્મ નાવેશ કંપનીઓ તરક થી. સ્પર્ધાત્મક, સિંગલ સ્ટેજ બે પેકેટ સિસ્ટમ, ઓપન ઈ–ટેન્ડર આમંત્રિત કરે છે. **"અમદાવા**દ ડિવિઝન પર વિવિધ સ્ટેશનો ખાતે એકાકી ધોરણે સ્ટેન્ડ પર વોટર વેન્ડિંગ મશીનનું ઈન્સ્ટોલેશન અને ઓપરેશન". વિગતો નીચે મુજબ છે :- રિઝર્વ કિંમત પ્રતિ વર્ષ : ₹ 40,000/- પ્રતિ વર્ષ અર્નેસ્ટ મની : ₹ 4,200/- બીડ **દસ્તાવેજનો ખર્ચ** : ₹ 5.900/- (18% GST સહિત)

|              | ડિવિઝન પર ઈન્સ્ટોલેશન અને ઓપરશન માટે WVM એકમોની વિગતો |                     |   |  |
|--------------|---|---------------------|---|--|
| તનું.<br>નં. | સ્ટેશન  | સ્ટેશનની<br>કેટેગરી | સ્થળ  |  |
| 1            | મણીનગર  | D                   | પ્લેટફોર્મ નં.2/3, હાલના WVM અને પોલ નં.2 વચ્ચે કવર શેડ હેઠળ  |  |
| 2            | મણીનગર  | D                   | પ્લેટફોર્મ નં.2/3, હાલના WVM થી આગળ, કવર શેડ હેઠળ અમદાવાદ તરફ |  |

**સુધારો / શુદ્ધિપત્રક જો હોય તોઃ** કોઈપણ સુધારા / શુદ્ધિપત્રક માટે ટેન્ડર બંધ થવાના સમય અને તારીખ સુધી કૃપા કરીને વેબસાઈટ <u>www.ireps.gov.in/</u> ની મુલાકાત લેવી. **ઈ-ટેન્ડર દસ્તાવેજ જમા કરાવવાનું બંધ થવાનો સમય અને** 2022 ના 15:00 કલાક સુધી અને તા. 30-09-2022 ના 15:30 કલાકે. **ઈ-ટેન્ડર ખુલવાની તારીખ થી ઓકરની માન્યતાઃ** 60 દિવસ. **વ્યવહાર માટેનું સરનામુંઃ** ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ (કોમરિયિલ), અમદાવાદ ડેવિઝન, પશ્ચિમ રેલવે, ચામુંડા માતા મંદિર પાસે, નરોડા રોડ, પોસ્ટ સૈજપુર બોઘા, અમદાવાદ-382345. વેબસાઈટ www.wr.indianrailways.gov.in

અમને લાઇક કરોઃ f facebook.com/WesternRly • અમને ફોલો કરોઃ 📂 twitter.com/WesternRly

#### આસ્વા ટ્રેડીંગ એન્ડ એક્ષપોર્ટસ લિમિટેડ

જેસ્ટર્ડ ઓફિસઃ ૩૨, મીલન પાર્ક સોસાયટી, જવાહર ચોક નજીક, મણીનગર, અમદાવાદ – ૩૮૦ ૦૦૮ કોરપોરેટ ઓળખ નંબર : L51100GJ1984PLC024704; ફોન: +91 9328784674 વેબસાઈટ : www.aaswatrading.in; ઈ-મેઈલ આઈડી : aaswaexports@yahoo.co.in

૩૭મી વાર્ષિક સાધારણ સભા અંગેની માહિતી બાબત

આથી નોટિસ આપવામાં આવે છે કે આસ્વા ટ્રેડિંગ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ ("ધ કંપની") ના સભ્યોની ૩૭મી વાર્ષિક સામાન્ય સભા (એજીમ) મંગળવાર, ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ૩૨, મિલન પાર્ક સોસાયટી, જવાહર યોક પાસે મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ ખાતે, તા.૯મી ઓગસ્ટ, ૨૦૨૨ની ૩૭મી એજીએમની નોટિસમાં નિર્ધારિત કરાચેલા કારોબાર માટે ચોજાશે. આ સૂચના પ્રોક્સી ફોર્મ, એટેન્ડન્સ સ્લિપ અને વાર્ષિક રિપોર્ટ જેમાં ડિરેક્ટર્સનો રિપોર્ટ, ઓડિટરનો રિપોર્ટ અને ઓડિટેડ નાગાકીય હિસાબી સામેલ છે તે તમામ સભ્યોને તેમના નોંધાયેલા સરનામાં પર મોકલવામાં આવ્યા છે અને તે કંપનીની વેબસાઇટ <u>www.aaswatrading.in</u> પર અને બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે. એજીએમની નોટિસ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. એજીએમની ઉપરોક્ત નોટિસ સાથે પ્રોક્સી રોજ પૂર્ણ થઈ ગઈ છે.

મીટિંગમાં ફાજરી આપવા અને મત આપવા માટે ફકદાર સભ્યને ફાજરી આપવા માટે પ્રોક્સીની નિમણૂક કરવાનો અને પોતાને બદલે હાજર રહેવાનો અને મત આપવાનો અધિકાર છે અને પ્રોક્સીએ કંપનીનો સભ્ય હોવો જરૂરી નથી. પ્રોક્સી અસરકારક બનવા માટે, પ્રોક્સી સ્લીપ યોગ્ય રીતે પૂર્ણ અને હસ્તાક્ષરિત કરીને કંપનીની રજિસ્ટર્ડ ઑફિસમાં એજીએમની શરૂઆતના ૪૮ કલાક પહેલા જમા કરાવવી પડશે. કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૮ ની જોગવાઈઓના પાલનમાં અને કંપનીઝ

(મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ના નિયમ ૨૦ સમય સમય પર સુધારેલા, સેબીના નિયમન ૪૪ (સ્**ચિબ**હ્ન જવાબદારીઓ અને ડિસ્ક્લોઝર . આવશ્યકતાઓ) નિયમો, ૨૦૧૫ અને ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ જનરલ મીટિંગ્સ પર સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ અનુસાર : કંપની તેના સભ્યોને ૩૭મી એજીએમની નોટિસ તારીખ ૯મી ઓગસ્ટ ૨૦૨૨માં

- નિર્ધારિત ઠરાવો પર ઈલેક્ટ્રોનિક માધ્યમથી તેમનો મત આપવા માટે રિમોટ ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડી રહી છે; . રિમોટ ઈ-વોટિંગ શરૂ કરવાનો દિવસ, તારીખ અને સમય: શનિવાર, ૨૪મી સપ્ટેમ્બર,
- ૨૦૨૨ (સવારે ૦૯:૦૦ કલાકે); iii. રિમોટ ઈ-વોટિંગનો છેલ્લો દિવસ, તારીખ અને સમય: સોમવાર, ર૬મી સપ્ટેમ્બર
- ૨૦૨૨ (સાંજે ૫:૦૦ કલાકે); iv. કટ-ઓફ તારીખ: મંગળવાર, ૨૦મી સપ્ટેમ્બર,૨૦૨૨;
- v. કોઈપણ વ્યક્તિ જે એજીએમની નોટિસ મોકલ્યા પછી કંપનીના શેર મેળવી કંપનીન સભ્ય બનેલ છે અને કટ-ઓફ તારીખ એટલે કે ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શેર ધરાવે છે, તે રિમોટ ઈ-વોટિંગ માટે aaswaexports@yahoo.co.in પર વિનંતી મોકલીને તેમનો ક્રમ નંબર મેળવી શકે છે અને એજીએમ નોટિસમાં દર્શાવેલ ઈ-વોટિંગ માટેની સૂચનાઓને અનુસર્યા પ્રમાણે પોતાનો મત આપી શકશે. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, શેરધારક રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ લિંક ઈનટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો પણ સંપર્ક કરી શકે છે અને જરૂરી લોગિન-આઈડી અને પાસવર્ડ મેળવી શકે
- vi. જે સભ્યો એજીએમમાં ફાજરી આપશે અને જેમણે રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો નથી તેઓ એજીએમમાં તેમના મતદાન અધિકારનો ઉપયોગ બેલેટ/પોલીંગ પેપર દ્વારા કરી શકશે. બેલેટ/પોલીંગ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા એજીએમના સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે;
- vii. સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે :
- a. સીડીએસએલ દ્વારા સોમવાર, ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યા પછી મતદાન માટે રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલને બંધ કરવામાં આવશે.
- b. જે સભ્યોએ પહેલેથી જ રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તેઓ સભામાં ફાજર રહી શકશે પરંતુ તેઓ એજીએમમાં ફરીથી તેમનો મત આપવા માટે
- c. કટ-ઓફ તારીખ એટલે કે ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના <u>રો</u>જ શેર ધરાવતા સભ્યો, માત્ર રિમોટ ઈ-વોટિંગ અથવા એજીએમમાં બેલેટ/પોલિંગ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા મેળવવા માટે હકદાર રહેશે.

રિમોટ ઈ-વોટીંગ/ઈ-વોટીંગ ને લગતા પ્રશ્નો/ખુલાસાઓ માટે સીડીએસએલ ની વેબસાઇટ <u>www.evotingindia.com</u> પર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો અને ઈ-વોટિંગ યુઝર મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો અથવા શ્રી રાકેશ દલવી, મેનેજર, સીડીએસએલ એ વિંગ, રપમો માળ, મેરેથોન કૂટુરેક્સ, મફતલાલ મિલ કમ્પાઉન્ડસ, એન. એમ. જોષી માર્ગ, લોઅર પરેલ (ઈસ્ટ), મુંબઈ – ૪૦૦૦૧૩, ઈમેલ <u>helpdesk.evoting@cdslindia.com</u> અથવા ટોલ ફ્રી ફ્રોન નંબર ૧૮૦૦૨૨૫૫૩૩ ઉપર સંપર્ક કરી શકાશે.

આસ્વા ટ્રેડિંગ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ વતી અનિતા રામચંદાની કંપની સેક્રેટરી તારીખ:૦૨.૦૯.૨૦૨૨

## YURANUS INFRASTRUCTURE LIMITED

CIN: L74110GJ1994PLC021352

રજિ. ઓફિસ: ૨૦૧, રજો માળ,મૌલીક આર્કેડ, કર્ણાવતી પગરખા બજાર ઉપર, માનસી ક્રોસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦ ૦૧૫, ફોન / ફેક્સ નં-૦૭૯-૨૬૭૩૩૩૫૩ ઈ મેઈલઃinfo@yuranusinfra.com, **Website:** www.yuranusinfra.com

ર૮મી વાર્ષિક સામાન્ય વિડિયો કોન્ફરન્સિંગ/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો હારા આયોજિત થનારી કંપનીની મીટિંગ અંગેની સૂચના આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૨૮મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બુધવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે યોજાશે. (IST) વિડિયો કોન્ફરન્સિંગ (VC) /અન્ય ઓડિયો-વિઝ્યુઅલ મીન્સ (OAVM) દ્વારા કંપની અધિનિયમ, ૨૦૧૩ અને તેના હેઠળ બનાવેલા નિયમોં અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ( SEBI) (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર જરૂરીયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫, સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૦૮ એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ. ૨૦૨૦. સામાન્ય પરિપંત્ર નં. ૨૦/૨૦૨૧ તારીખ ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા જારી કરાયેલા અન્ય લાગુ પરિપત્રો અને પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/ 79 તારીખ ૧૨ મે, ૨૦૨૦ના પરિપત્ર નંબર SEBI સાથે વાંચો HO/CFD/CMD2/ CIR/P/2021/11 તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ (સામૂહિક રીતે સંબંધિત પરિપત્રો તરીકે ઓળખવામાં આવે છે), AGM કૉલિંગ નોટિસમાં નિર્ધારિત કર્યા મુજબ વ્યવસાયનો વ્યવહાર કરવા. સભ્યો એજીએમમાં VC/OAVM દ્વારા હાજરી આપી શકશે. VC/ OAVM સુવિધા દ્વારા ભાગ લેનારા સભ્યોને કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ કોરમના હેતું માટે ગણવામાં આવશે.

સંબંધિત પરિપત્રોના પાલનમાં, વાર્ષિક અહેવાલ ૨૦૨૧-૨૨ જેમાં એજીએમની નોટિસ અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેના નાણાકીય નિવેદનો સાથે બોર્ડના અહેવાલ, ઓડિટર્સ રિપોર્ટ અને તેની સાથે જોડવાના જરૂરી અન્ય દસ્તાવેજોને મોકલવામાં આવશે. કંપનીના તમામ સભ્યો કે જેમના ઈ-મેલ એડ્રેસ કંપની/ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ(ઓ) સાથે નોંધાયેલા છે. ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.yuranusinfra.com પર, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે BSE લિમિટેંડ www.bseindia.com પર અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) https:// www.evoting.nsdl.com. પર પણ ઉપલબ્ધ હશે.

ડીમટીરિયલાઈઝ્ડ/ફ્રિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો અને તેમના ઈમેલ એડ્રેસની નોંધણી ન કરાવેલ સભ્યો માટે દૂરથી મતદાન કરવાની રીત, સૂચનામાં આપેલી સૂચનાઓને અનુસરો. ઈ-વોટિંગ હારા વોટ નાખવાની રીતઃ

(a) સભ્યોને ઇલેક્ટ્રિક વોટિંગ સિસ્ટમ (ઈ-વોટિંગ) દ્વારા એજીએમની નોટિસમાં નિર્ધારિત કર્યા મુજબ બિઝનેસ પર તેમનો મત આપવાની તક મળશે.

(b) ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાની સુવિધા એજીએમમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે (એનએસડીએલની વેબસાઇટ પર) અને એજીએમમાં હાજરી આપનારા સભ્યો કે જેમણે રિમોટ ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો નથી. એનએસડીએલની વેબસાઈટ દ્વારા એજીએમમાં મતદાન કરવા માટે. (c) ઈ-વોટિંગ દ્વારા મત આપવા માટેના લોગિન ઓળખપત્ર સભ્યોને ઈમેલ દ્વારા ઉપલબ્ધ

કરાવવામાં આવશે. જે સભ્યો ઈમેલ મેળવતા નથી અથવા જેમના ઈમેલ એડ્રેસ કંપની /NSDL/ ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધાયેલા નથી, તેઓ એજીએમની નોટિસમાં આપેલી સૂચનાઓને અનુસરીને લોગિન ઓળખપત્રો જનરેટ કરી શકે છે. (d) એ જ લૉગિન ઓળખપત્રોનો ઉપયોગ VC/OAVM દ્વારા એજીએમમાં હાજરી

આપવા માટે પણ થઈ શકે છે. સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એજીએમની નોટિસમાં મોકલવામાં આવેલી તમામ નોંધો અને ખાસ કરીને એજીએમમાં જોડાવા માટેની સૂચનાઓ, રિમોટ ઈ-વોટિંગ દ્વારા અથવા એનએસડીએલની વેબસાઈટ દ્વારા એજીએમ દરમિયાન મતદાન કરવાની રીતને ધ્યાનપૂર્વક વાંચે.

શેરધારકો કૃપા કરીને નોંધ લે કે ઉપરોક્ત પરિપત્રોના સંદર્ભમાં, કંપની એજીએમ નોટિસ અને વાર્ષિક અહેવાલની ભૌતિક નકલો શેરધારકોને મોકલશે નહીં. આ નોટિસ કંપનીના તમામ સભ્યોની માહિતી અને લાભ માટે જારી કરવામાં આવી છે અને તે MCA અને SEBIના લાગુ પરિપત્રોનું પાલન કરે છે.

> **યુરેનસ ઇન્ફાસ્ટ્રકચર લિ..** સહી/- મોહિત દિનેશ દેસાઇ મેનેજીંગ ડીરેક્ટર ડીનઃ ૦૩૦૮૯૪૨૦

તારીખ: ૦૩.૦૯.૨૦૨૨

<mark>તારીખ</mark> : 02/09/2022 સ્થળ : અમદાવાદ.

(મેનેજિંગ <mark>ડિરેકટર</mark>)

# SJVN eyeing to tap 5,000 MW renewable energy in Punjab

ter signing a pact for developing 10,000 MW solar projects and parks in Rajasthan, public sector SJÝN is now eyeing to tap renewable energy in Punjab, which holds a huge potential for generation from agro-residues, an alternative model of diversification, besides solar power.

SJVN Chairman and Managing Director Nand Lal Sharma met Punjab Chief Minister Bhagwant Mann in

Chandigarh on Thursday and expressed keen interest in developing 5,000 MW renewable energy projects in the state.

Sharma told IANS that he proposed to develop solar energy projects either by way of joint ventures formation or memoranda of understand by setting up canal top projects and floating solar projects across the state.

Chief Minister Mann assured all possible support

WESTERN RAILWAY TO EXTEND THE TRIPS OF SUPERFAST FESTIVAL SPECIAL TRAIN

projects, he said.

Sharma made a comprehensive presentation and apprised that SJVN has 42,000 MW in its kitty, which includes a strong re-

newable portfolio.
"SJVN has outlined a roadmap for developing renewable energy in Punjab due to exponential power demand owing to developmental activities. SJVN looks forward to be a strategic partner in this growth

CHANGE OF NAME

have change my name from

JOHER TAHERBHAI

**DUDHWALA** to **JOHAR** 

TAHERBHAI VORA

Add: 501, Sunrise Flats,

B/h Tagore Hall, Kochrab

Paldi. Ahmedabad-380006

KANKESHWARIDEVI INSTITUTE

**OF TECHNOLOGY JAMNAGAR** 

APPOINTMENT

1

2 2 2

3 2

Colleges. Only qualified candidates send their detail

resume with necessary mark sheet and documents on

or before Dt.10-09-2022 by registered A.D. or Speed

post on above address. Qualification as per AICTE, GTU

E-Mail : hrkankeshwari@gmail.com Contact : 70164 11900

YURANUS INFRASTRUCTURE LIMITED

CIN - L74110GJ1994PLC021352 Reg. Office: 201, 2ND FLOOR, MAULIK ARCADE, ABOVE

KARNAVATI PAGARKHA BAZAR, MANSI CROSS ROAD, VASTRAPUR AHMEDABAD-380015 **Ph**: 079-26733353

Email: info@yuranusinfra.com Website: www.yuranusinfra.com

NOTICE ON INFORMATION REGARDING 28TH ANNUAL GENERAL

MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO

**CONFERCING/ OTHER AUDIO VISUAL MEANS** 

Notice is hereby given that the 28th Annual General Meeting ("AGM") of

Notice is releasely given that the Zont Allidad Seried in Wednesday, 28th day of September, 2022 at 12:00 p.m. (IST) through Video Conferencing ("VC") /Others Audio-Visual Means ("OAVM") in compliance with all the applicable provisions of the companies Act, 2013 and the Rules made there-

under and the Securities and exchange Board of India ("SEBI") (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with general circular No. 14/2020 dated April 08, 2020, General Circular No.

17/2020 dated April 13, 2020 dated April 00, 2020, General Circular No. 20/2021 dated 13th January, 2021 and other applicable circulars issued by the Ministry of

Corporate Affairs ("MCA") and Circular No. SEBI/HO/CED/CMD1/CIR.

CMD2/CIR/P/2021/11 dated January 15. 2021 (collectively referred to as

relevant circulars"), to transact the business as set out in the Notice call-

mbers participating through the VC/OAVM facility shall be reckoned for

ing AGM. Members will be able to attend the AGM through VC/ OAVM

the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

In compliance with the relevant circulars, the annual report 2021-22

consisting of notice of the AGM and the Financial Statements for the

financial year 2021-22 along with Board's Report, Auditors Report and other documents required to be attached thereto, will be sent to all the

members of the company whose E-mail addresses are registered with

the Company/ Depository Participant(s). The aforesaid documents will

also be available on the company's website at www.yuranusinfra.com,

on the website of the stock exchange i.e. BSE limited at www.bseindia.com and on the website of National Securities Deposi-

The manner of voting remotely for members holding shares in demate

rialized/physical mode and members who have not registered their emai

(a) Members will have an opportunity to cast their vote(s) on the busi-ness as set out in the notice of the AGM through electric voting

system ("e-voting"). The facility for voting through electronic voting system will also be made available at the AGM ("On the website of NSDL") and mem-

bers attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM through NSDL website.

The login credentials for casting votes through e-voting shall be made available to the members through email. Members who do

not receive email or whose email addresses are not registered with the company/ NSDL / Depository participant(s), may generate login

credentials by following instructions given in the notes to Notice of

The same login credentials may also be used for attending the

Members are requested to carefully read all the Notes set out in the

Notice of the AGM to be dispatched and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or

Share holders may please note that in terms of aforementioned circulars, the company will not send physical copies of AGM notice and Annual

This notice is being issued for the information and benefit of all the

members of the Company and is in compliance with the applicable

For, Yuranus infrastructure Ltd.

sd/- Mohit Dinesh Desai

Managing Director

DIN: 03089420

addresses, follow the instructions as provided in the Notice.

tory Limited (NSDL) https://www.evoting.nsdl.com.

Manner of casting vote(s) through e-voting:

AGM through VC/OAVM.

Report to the Shareholders.

Date: 03.09. 2022

Place: Ahmedabad.

circulars of the MCA and SEBI.

through website of NSDL during the AGM.

20/79 dated May 12, 2020 read with Circular No. SEBI/HO/CFD/

Nr. Narnapara Forest Nursery, Opp. Ranjit Sagar Dam, Jamnagar - Samana Road, Jamnagar - 361010

Computer Electrical Physics

1

2

|-|1|-|1|

|-|-|6|-|5|-|-|-

well qualified faculty for Engineering

Chemi

2328/

story of Punjab by harnessing green energy," said

oping a 100-MW solar power project in Punjab with an outlay of Rs 545 crore and the power purchase agreement for this was signed with Puniab State Power Corp Ltd

CHANGE OF NAME have change my name from YAKUTA JOHER **DUDHWALA** to **YAKUTA** 

B/h Tagore Hall, Kochrab, Paldi, Ahmedabad-380006

CHANGE OF NAME have change my name from VAGHELA RUPAL ANIRUDDHASINH to

Ranip, Ahmedabad 2329 CHANGE OF NAME

I have change my name fron JAVANIKA RAVIKUMAR PATEL to JAVANIKABEN RAVI PATEL Add: 55. Dipen Nagar

LAXMI GOLDORNA HOUSE LIMITED CIN: L36911GJ2010PLC059127

Reg. Office: Laxmi House, Opp. Bandharano Khacho, M G Haveli Road, Manek Chowk, Ahmedabad-380001, Gujarat, India Email: cs@laxmilifestyle.co.in • Website: www.laxmilifestyle.co.in NOTICE TO THE MEMBERS OF THE COMPANY REGARDING 13TH

ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VC / OAVM

Notice is hereby given that the 13<sup>th</sup> Annual General Meeting ("AGM")of the members of Laxmi Goldorna House Limited ("the Company") will be convened or Friday, 30" September, 2022 at 02:15 PM IST through Video Conferencing ("VC" or Other Audio Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 ('Act') & Rules framed there under and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 reac with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 08, 2020, April 13, 2020 and May 05, 2020 and Circular No SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No 02/2021 dated January 13, 2021 and December 14,2021 and all other relevant circulars issued from time to time, respectively by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Securities and Exchange Board of India ('SEBI Circular') to transact the business as set forth in the AGM Notice, without the physical presence of the Members at a common venue.Further, SEBI vide its circular dated may 13, 2022 has allowed listed entities to send their annual report in electronic

The Notice of 13th AGM and the Annual Report for the financial Year 2021 22("Annual Report") will be sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depositary Participants ("Depositary"), in accordance with the MCA Circular/s and the SEBI

Members who have not registered their e-mail addresses with the Depositories/Company/Registrar and Share Transfer Agent ('RTA'), so far, are requested to register/update their e-mail addresses in the following manner:

(i) In respect of electronic/demat holdings with the Depository through their concerned Depository Participants. However, the members may temporarily register the same with the Company by providing details such as Name, DP ID,

Client ID, PAN, Mobile number and email address to cs@laxmilifestyle.co.in ii) All the Equity Shares of the Company are held by the members in the

Members can join and participate in the 13th AGM through VC/OAVM facility nly. Necessary arrangements have been made by the Company with National Securities Depositories Limited ('NSDL') to facilitate e-Voting. The instruction of joining the 13th AGM and the manner of participation in the remote electronic voting or casting vote through e-voting system during the 13th AGM is provided in the Notice of the 13th AGM. Members participating through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013. The Notice of 13" AGM and the Annual Report will also be available on the website of the Company i.e. www.laxmilifestyle.co.in and the vebsite of NSE India Limited i.e. www.nseindia.com.

The Cut-off Date has been fixed as Friday, 23<sup>nd</sup>September, 2022 for the ourpose of voting entitlement for AGM and for determining the names of eligible nembers for the financial year ended March 31, 2022.

The above information is being issued for the information and benefit of all the Members of the Company and is in Compliance with the MCA Circular/s and SEBI

For, Laxmi Goldorna House Limited Sd/- Jayesh Chinubhai Shah (Managing Director)

Date: 02/09/2022



LEELA CHAMPAK CHARITABLE TRUST SANCHALIT

ATUL POLYTECHNIC-KHADAT

Email: atulpolytechnic2008@gmail.com Web: www.atulpolytechnic.com

| BRANCH                        | HOD | LECTURER |
|-------------------------------|-----|----------|
| <b>AUTOMOBILE ENGINEERING</b> | 1   | 09       |
| CIVIL ENGINEERING             | 1   | 09       |
| COMPUTER ENGINEERING          | 0   | 04       |
| ELECTRICAL ENGINEERING        | 1   | 04       |
| MECHANICAL ENGINEERING        | 1   | 10       |
| PHYSICS                       | =   | 1        |
| ENGLISH                       | =   | 1        |
| CHEMISTRY                     | -   | 1        |
|                               |     |          |

Qualification, Experience and pay scales for all the posts are as per AICTE & GTU Norms. Post may be varying at the time of interview. Eligible & interested candidates requested to send their application along the all certificates (Self attested) to Managing Trustee on or before 17-09-2022 along with 2 recent passport size photos. Applications send through E-mail will be eligible for scrutiny. Application received due to postal delay would not be scrutinized.

Note: He/She is not entitled for TA/DA on date of interview.

Managing Trustee

## CHANGE OF NAME

have change my name from MUFFADDAL JOHER DUDHWALA to MUFFADDAL JOHER VORA Add: 501, Sunrise Flats, B/h Tagore Hall, Kochrab.

Paldi, Ahmedabad-380006

I have change my name fron RAVIKUMAR PRAHLADBHAI PATEL to RAVI PRAHLADBHAI PATEL Add: 55. Dipen Nagar. Vastral, Ahmedabad



**GUJARAT WATER SUPPLY AND SEWERAGE BOARD** "for complaints regarding rural drinking water supply Pl contact toll-free helpline No.1916 of GWSSB"

#### **TENDER NOTICE NO - 9/2022-23**

Superintending Engineer, Public Health Works Circle, 1st Floor, Sardar Vallabhbhai Patel Shopping Center, Sardarnagar Circle, Sardarnagar, Bhaynagar, Phone No.(0278) 2565082 invites Under (1) Construction of RCC Sump Gravity pipeline and pumping machinaries for village level storage under Pasvi Group Tal, Talaia/Mahuya/Palitana Dist, Bhaynaga Rs.5,40,67,347.96 Tender I.D.No.545747 (2<sup>nd</sup> Attempt) (2) Augmentation of Bordi Group Water Supply Scheme Tal.Sihor Dist.Bhavnagar Rs.6,87,54,892.56 Tender I.D.No.545722 (3rd Attempt) by E.Tendering Online tender with two Bid System from Registered contractors for above mention works. The detail information are available on website https:// gwssb.nprocure.com Last Date for Online Submission Dt.29-09-2022 till 18:00 Hours Any further changed/amendments here after shall be published online only. DDI/BVN/547/22

#### **WESTERN RAILWAY**

#### e-Auction

Divisional Office Mumbai Central, Mumbai-400008 invites e-auction for the contrac Divisional Office maintain extends, inclinal-books universe evaluation for the contract to lease out parcel SLR in trains originating from Mumbai Division has been invited The catalogue has already been published on IREPS website, the details are

| Turmoneu de unaer :   |                  |               |                |  |  |
|-----------------------|------------------|---------------|----------------|--|--|
| Auction catalogue no. | Type of contract | Category      | Contact period | Date & time of e-Auction   |  |
| MMCT-PLS-<br>22-34    | Parcel           | PARCEL<br>SLR | 2 Years        | E-auction for lot will start at<br>12.00 hrs. on 15.09.2022.<br>Initial cooling period in 30 minutes |  |
| MMCT-PLS-<br>22-35    | Parcel           | PARCEL<br>SLR | 2 Years        | E-auction for lot will start at<br>12.00 hrs. on 16.09.2022.<br>Initial cooling period in 30 minutes |  |
| MMCT-PLS-<br>22-36    | Parcel           | PARCEL<br>SLR | 2 Years        | E-auction for lot will start at<br>12.00 hrs. on 19.09.2022.<br>Initial cooling period in 30 minutes |  |

Note: Prospective bidders are requested to visit e-Auction leasing module on IREPS vebsite (www.ireps.gov.in). The lot wise details are available there in under the mentioned catalogue. Initial cooling off period is 30 minutes. Successive Lot closing interval is 10 Minutes. Lot wise closing times can be viewed in e-auction

Like us on : facebook.com/WesternRly Follow us on : wtwitter.com/WesternRly

#### ROBERT RESOURCES LIMITED

CIN: - L99999GJ1982PLC096012 REGD. OFF: - 3rd FLOOR, PLOT NO 1067, OPP. BINDU NIVAS, KALIYABID ROAD,

BHAVNAGAR-364001, GUJARAT, Contact No: +91-6358905872 E-mail :- robertresourceslimited@gmail.com | Website: - www.robertresources.com

## NOTICE OF 40TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 40th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 30th September, 2022 at 5:00 P.M. at the Registered Office of the Company to transact the business as mentioned in the AGM Notice.

In compliance with the relevant circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2021-22 will be sent to all the shareholders whose email addresses are registered with the Company/Depository Participant(s). Shareholders holding shares in dematerialized mode and whose email ids are not registered are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depositary participants. Shareholders holding shares in physical mode are requested to get their shares in demat mode / furnish their email addresses and mobile numbers with the Company on robertresourceslimited@gmail.com and its Registrar and Share Transfer Agent i.e. skyline Financial Services Private Limited at info@skylinerta.com.The notice of the 40th AGM and Annual Report 2021-22 will also be made available on the Company's website at www.robertresources.com and the Stock Exchanges websites at www.msei.in and www.cse-india.com.

Shareholders will have an opportunity to cast their vote through remote e voting system or during the AGM on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of voting for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the shareholders

Members who have not registered their E-mail address are requested to get the same registered, the Company will send the Notice of the 40th AGM and Annual Report for the year 2021-22 by way of an E mail only to those shareholders whose E-mail ID are gistered with Company / Depository Participants

Place : Bhavnagar For, Robert Resources Limited Date :2nd September, 2022 Ami Kothari Company Secretary & Compliance officer

## VINYOFLEX LIMITED

Regd. Off: 307, Silver Chamber, Tagore Road, Rajkot - 360 002. CIN: L25200GJ1993PLC019830 Ph.: 0281-2468345, 2468776 Fax: 0281-2468839 

#### NOTICE OF 29<sup>™</sup> ANNUAL GENERAL MEETING, **EVOTING INFORMATION, BOOK CLOSURE AND RECORD DATE**

1. Notice is hereby given that the 29th Annual General Meeting of Members of VINYOFLEX LIMITED will be held at registered office situated at 307, Silver Chambers, Tagore Road, Rajkot on **Thursday 29th September, 2022** at **11.00** A. M. to transact the Ordinary Businesses, As set out in the Notice dated 01st September 2022 in compliance with the applicable provisions of the Companies Act, 2013 and rules farmed there under and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Notice of AGM, Annual Report and Attendance Slip has been sent in Electronic Mode to all Members in the Permitted Mode. The above documents are also available on the Company's Website www.vinyoflex.com.

#### 2. Dispatch of Annual Report through E-mail Only:

Members may note that the Annual Report of the Company for the Financial Year 2021-22 along with Notice convening the AGM has been sent only through email to all those Members whose email addresses were registered

with the Company/RTA or with their respective Depository Participant(s) (DP) as on the date 30-08-2022, in accordance with the MCA Circulars and Circular

No. SEBI/HO/CFD/CMD1/CINP/2020/79 dated May 12, 2020, January 15, 2021 and May 13, 2022 issued by SEBI. Further. Members holding shares in physical form and who have not yet registered/updated their email address are requested to update their Mail Id by submitting forms given at the website of the Company **www.vinyoflex.com** 

#### 3. Remote E voting Information:

In compliance with provisions of section 108 of the Companies Act, 2013 read with rules made there under as amended from time to time and Regulation44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Company is pleased to provide members facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means through e-Voting Services provided by National Securities Depository Limited (NSDL). All members are informed that

1) The businesses as stated in the Notice of 29th AGM will be transacted through voting by electronic means; 2) The e-voting period commences as on Saturday, 24th September 2022 (9 a.m.) and ends on Wednesday, 28th September 2022 (5 p.m.).

 $3) The \ cut-off \ date for \ determining \ the \ eligibility \ to \ cast \ vote \ by \ electronic \ means \ is \ September \ 22, \ 2022.$ 

4) A person who is not a Member as of the Cut-off date should treat this notice for Information purpose only. The persons who acquire shares and become members of the Company after dispatch of the Notice of AGM through Email and holding shares as on the cut-off date i.e. September 22, 2022 may obtain Login Id and Password by sending a request on or before September 22, 2022 at evoting@nsdl.co.in or info@vinyoflex.com and may cast their votes by following the instructions and process of e-voting as provided in the Notice of AGM.

5) In case of any gueries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section o www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to at evoting@nsdl.co.in.

6) The members may note that: (a) once the e-vote on resolution is cast by members, they shall not be allowed to change it subsequently, (b) The members who have cast their vote by remote e-voting may also attend physical AGM but shall not be entitled to cast their vote again.

#### 4. Book Closure and Record Date:

Pursuant to Regulation 42 and 60 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 91 of the Companies Act, 2013 and the applicable Rules there under the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Tuesday 20th September, 2022 To Thursday, 29th September, 2022 (Both Days Inclusive) for the purpose of AGM and cut-off date (record date) is 22rd September

The said notice is also available on website of stock exchanges www.bseindia.com and on company's website

www.vinyoflex.com Date:03-09-2022

Place: Rajkot

by Order & behalf of the Board of Directors for Vinvoflex Ltd

> CS. RAHUL KHOKHAR **COMPANY SECRETARY** M.NO. A62029

# BETWEEN AHMEDABAD AND OKHA WITH REVISED TIMINGS

| TRAIN<br>NO.   | ORIGINATING STATION & DESTINATION    | DAYS OF<br>SERVICE          | DEPARTURE  | ARRIVAL                      |
|--|--------------------------------------|-----------------------------|------------|------------------------------|
| 09435  | AHMEDABAD - OKHA<br>(Every Saturday) | 03.09.2022 to<br>22.10.2022 | 23.25 hrs. | <b>08.25 hrs.</b> (Next day) |
| 09436  | OKHA - AHMEDABAD<br>(Every Sunday)   | 04.09.2022 to<br>23.10.2022 | 23.45 hrs. | 08.45 hrs.<br>(Next day)     |
| Halt Stations: Chandlodiya, Viramgam, Surendranagar, Than, Wankaner, Rajkot, Hapa, |                                      |                             |            |                              |

Jamnagar, Khambhalia and Dwarka stations in both directions. Composition: 3-Tier AC, Sleeper Class and General Second Class Coaches.

For detailed timings of the halts, please visit www.enquiry.indianrail.gov.in The booking of Train No. 09435/09436

will run as Special Train on Special Fare

will open on 03.09.2022 at PRS counters and on IRCTC website. The above trains

**WESTERN RAILWAY** www.wr.indianrailways.gov.in Like us on: facebook.com/WesternRly

Follow us on: twitter.com/WesternRly

PLEASE CARRY ORIGINAL ID PROOF FOR ALL RESERVED TICKETS

have change my name from

CHAWDA

DUSHYANTKUMAR

NARPATSINH to CHAWDA

DUSHYANTSINH

**NARPATSINH** 

Add: 16, Santoor Bunglows

Iscon Ambali Road,

Ahmedabad-380058

**Cadre Post** 

Professor

Associate

**Professor** 

**Assistant** 

H.O.D.

and State Govt. Norms.

Lecturer

Principal - 1

#### CHANGE OF NAME

have change my name from BHAGWATI GOVINDSINH JADAUN to **BHAGWATIKUMARI CHANDRABHANUSINH VAGHELA** Add: 7, Bharat Colony Naranpura, Ahmedabad

#### CHANGE OF NAME

I have change my name from NITTALBEN **SANDIPKUMAR PATEL** to **NITALBAHEN** SANDIPKUMAR PATEL Add: D-202, Shyam Avirahi Nikol, Ahmedabad 2330/

I have change my name from **PATEL HARSH MUKESHKUMAR** to **PATEL** HARSH MUKESHBHAI Add: 17-B, Rambag Society Sahakari Jin Road. Himatnagar, Dist.Sabarkantha-383001

CHANGE OF NAME ANDRIA JACKSONBHAI **CHRISTIAN** to **ANDRIA** JACKSON CHRISTIAN Add: 2, Bethleham Society

I have change my name from JACKSONBHAI JAYANAND **CHRISTIAN** to **JACKSON** JAYANANDBHAI **CHRISTIAN** 

## CHANGE OF NAME

**CHRISTIAN** to **FEROLINA** JACKSON CHRISTIAN Add: 2, Bethleham Society, Nr. Dhiraj Society, Khokhara, Dist.Sabarkantha-380008 2331B

#### VARIOUS MAINTENANCE WORKS FOR NATIONAL ACADEMY OF INDIAN RAILWAY

e-Tenders for and on behalf of th President of India are invited by Sr Professor (civil Eng.) National Academ of Indian Railway Lal Baugh, Vadodara 390004 for the following works. (1) Tender No. NAIR-SPCE-CAMPUS-2022-23-02 (2) Name of Works Maintenance of Gardens, Lawns and surrounding area in the campus of National Academy of Indian Railways Lalbaug, Vadodara for 24 (twenty four months. (3) Approximate cost of the work: ₹ 46.79.444.19 (4) Bid Security to be deposited: ₹ 93,600.00 (5) Dat and time for submission of e-tende and opening of e-tender: On line tender is to be submitted on 26-09-2022 before 15.00 Hrs. and is to be opened of same date at 15.30 Hrs. (6) Website particulars and notice for location where complete details can be seer etc.: National Academy of Indian Railway, Lalbaug, Vadodara-390 004. Web site @ www.ireps.gov.in BRC-1

#### Follow us on: twitter.com/WesternRly

CLEANING AND PAINTING OF Tender as per the details given below Bshot-06 (1) Name of Work: Cleaning

(

Degree

Engineering

Diploma

Engineering

2330

CHANGE OF NAME

I have change my daughter's Nr. Dhiraj Society, Khokhara Dist.Sabarkantha-380008 2331A

## CHANGE OF NAME

Add: 2, Bethleham Society Nr. Dhiraj Society, Khokhara, Dist.Sabarkantha-380008

I have change my name from FEROLINA JACKSONBHAI

# WESTERN RAILWAY - VADODARA DIVISION

e-TENDER NOTICE NO. NAIR-SPCE-CAMPUS-2022-23-02

WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION **BOGIE FRAME & ITS COMPONENTS** For and behalf of The President of India Dy. Chief Mechanical Engineer Bhavnagar Para, Carriage Repai Workshop, Bhavnagar Para, invite E-Tender Notice No. BVPW-2022-23 Bogie frame & its components by Shot/Grit blasting and Painting of cleaner Bogie frame and its components. (2 Approx. cost of work: ₹ 99,77,458.84/ (3) Bid security to be deposited ₹ 1,99,600/- (4) Date and Submission of k 1,99,000/- (4) Date and submission: 19-bid and opening of bid: Submission: 19-09-2022 up to 15:00 hrs. Opening: 19-09-2022 after 15:30 hrs. (5) Website particulars and address of the office: CWM-BVP's Office, Carriage Repair Workshop, Bhavnagar Para-364003 Website: www.irons.cov.in ebsite: www.ireps.gov.in

## Like us on: f facebook.com/WesternRly

Sharma. Currently, SJVN is devel-

(PSPCL) on June 23.

**JOHAR VORA** Add: 501, Sunrise Flats,

VAGHELA RUPRAJBA ANIRUDDHASINH Add: 40, Rajeshwari Society

Vastral, Ahmedabad

Next Axis Bank, Nr. Wir Bungalows, Mahudi Mandir Road, Taluka: Mansa, District: Gandhinagar. Phone: 02763-284312, 284319

# APPLICATIONS ARE INVITED FROM INTERESTED CANDIDATES FOR FACULTY POSITIONS IN THE FOLLOWING DISCIPLINES

| BRANCH                        | HOD | LECTURER |
|-------------------------------|-----|----------|
| <b>AUTOMOBILE ENGINEERING</b> | 1   | 09       |
| CIVIL ENGINEERING             | 1   | 09       |
| COMPUTER ENGINEERING          | 0   | 04       |
| <b>ELECTRICAL ENGINEERING</b> | 1   | 04       |
| MECHANICAL ENGINEERING        | 1   | 10       |
| PHYSICS                       | -   | 1        |
| ENGLISH                       | -   | 1        |
| CHEMISTRY                     | _   | 1        |

#### AASWA TRADING AND EXPORTS LIMITED Reg. Off.: 32, Milanpark Society, Nr. Jawahar Chowk, Ahmedabad – 380008 CIN: L51100GJ1984PLC024704; Telephone: +91-9328784674 Website: www.aaswatrading.in; E-mail Id: aaswaexports@yahoo.co.in

NOTICE OF 37<sup>™</sup> ANNUAL GENERAL MEETING Notice is hereby given that the 37th Annual General Meeting (AGM) of the Members of the Aaswa Trading and Exports Limited ("The Company") will be held on Tuesday. 27th September, 2022 at 11:30 a.m. at 32, Milan Park Society, Nr. Jahawar Chowk, Maninagar, Ahmedabad-380008, Gujarat, to transact the business as set out in the Notice of 37th AGM dated 09th August, 2022. The said Notice alongwith Proxy Form, Attendance Slip and Annual Report Inter-alia containing Directors Report, Auditors Reports and Audited Financial Statements has been dispatched to all the Members at their registered addresses and the same is also available on the website of the Company at www.aaswatrading.in and on the website of Bombay Stock Exchange at www.bseindia.com. The Notice of AGM is also available on the website of Central Depository Services (India) limited (CDSL) at www.evotingindia.com. The dispatch of above mentioned Notice of AGM along with proxy form, attendance sip and annual

report has been completed on 02nd September, 2022. A member entitled to attend and vote at the meeting is entitled to appoint a proxy to attend and Vote instead of himself/herself and the proxy need not to be a member of the Company Proxies in order to be effective, should be deposited at the Registered Office of the Company, duly completed and signed, not less than 48 hours before the

commencement of the AGM. In compliance with provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time, Regulation 44 of SEBI (listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard on General Meetings

- issued by The Institute of Company Secretaries of India: i. The Company is providing remote e-voting facility to its Members to cast their Vote by electronic means on the Resolutions set out in the Notice of the 37th AGM dated
- 09th August 2022: ii. Day, Date and Time of commencement of remote e-voting: Saturday, 24th September, 2022 (09:00 a.m.);
- iii. Day, Date and Time of end of remote e-voting: Monday, 26th September, 2022 (5:00 p.m.);
- iv. Cut-off date: Tuesday, 20th September, 2022;
- v. Any person who acquires shares of the Company and becomes a member of the Company after the dispatch of AGM Notice and holds shares as on the cut-off date i.e.  $20^{\text{th}}$  September, 2022, can obtain their Sequence No. for remote e-voting by sending a request at <a href="mailto:asswaexports@yahoo.co.in">and caste vote after following</a> the instructions for E-Voting as mentioned in the AGM Notice. In case of any queries, the shareholder may also contact the Registrar and Transfer Agent viz Link Intime India Private Limited and obtain the necessary login-Id and Password;
- vi. The members who will be attending AGM and who have not caste their vote through remote e-voting shall be able to exercise their voting rights at the AGM. The facility for voting through ballot/polling paper shall be made available at the venue of the AGM:

#### vii. The Members are requested to note that:

Date: 02.09.2022

- a. Remote e-voting module shall be disabled by CDSL for voting after 05:00 p.m. on Monday, 26 September, 2022:
- The members who have already cast their vote through remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again at the AGM; c. Members holding shares as on the cut-off date i.e. 20th September, 2022.
- shall only be entitled to avail the facility of remote e-voting or voting through ballot/polling paper at the AGM. In case of any queries / grievances pertaining to remote e-voting / e-voting, you may

refer the Frequently Asked Questions and e-voting user manuals available at the CDSL

website www.evotingindia.com or contact Mr. Rakesh Dalvi, Manager, CDSL, A Wing,

25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013, E-mail: helpdesk.evoting@cdslindia.com, or call on toll free no. 1800 22 55 33. For Aaswa Trading and Exports Limited Place: Ahmedabad Anita Ramchandani

**Company Secretary** 

## Ahmedabad, Page 7